

એકમ નંબર - ૬ એકમનું નામ - ધૂળિયે મારગ (ગુજરાતી, ધોરણ -૮)

પ્રશ્ન - ૧ નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(૧) ઉપરવાળી બેંક કેવી નથી ?

(અ) કંગાલ (બ) માલામાલ (ક) કાલની ચિંતા કાલ કરનાર (ડ) એક પણ નહીં

(૨) ધૂળિયે મારગ શું મળે છે ?

(અ) ધૂળ (બ) વાર્તાની ચોપડી (ક) સુખ દુઃખ (ડ) આપણા જેવો સાથ

(૩) ધૂળિયે મારગ શું નથી ?

(અ) ખુલ્લા ખેતર (બ) નીલું આભ (ક) સોનાની ગલી (ડ) નાનું ગામડું

(૪) કાવ્યમાં માનવીને ભાળીને કઈ લાગણી થાય છે ?

(અ) દુઃખની (બ) દરિદ્રતાની (ક) સ્વાર્થની (ડ) વ્હાલની

(૫) કવિ નોટ - સિક્કાને ક્યાં નાખવાનું કહે છે ?

(અ) ખિસ્સામાં (બ) પર્સમાં (ક) નદીમાં (ડ) ધૂળિયા માર્ગે

(૬) સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત ;

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને, પ્રેત ! આ પંક્તિ શો બોધ આપે છે ?

(અ) સંતોષી નર સદા સુખી (બ) અડધો મળે તો આખા પાછળ ણ દોડાય

(ક) લાંબા પાછળ ટૂંકો જાય, મારે નહીં તો માંડો થાય (ડ) ત્રણેય

પ્રશ્ન - ૨ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.

(૧) ગરીબ

(૨) ખોટ

(૩) સાથ

(૪) બાથ

(૫) ફોરવું

પ્રશ્ન - ૩ નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલ શબ્દો શોધી લખો.

- (૧) રસ્તો
- (૨) વાર્તા
- (૩) પૈસા
- (૪) જોઈ
- (૫) મહેકે
- (૬) કેટલાય

પ્રશ્ન - ૪ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.

- (૧) રાંક
- (૨) ખોટ
- (૩) આજ
- (૪) લાભ
- (૫) સાંકડી

પ્રશ્ન - ૫ નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો

- |  |             |
|--|-------------|
| (૧) કવિ પાસે થોડીક નોટ અને સિક્કા નથી, એ બાબતની એમને ખોટ છે.       | ખરું, ખોટું |
| (૨) ખુલ્લા ખેતર અને આભની વચ્ચે મોટું શહેર છે.                      | ખરું, ખોટું |
| (૩) ઉપરવાળી બેંક આજનું ખાણું કાલ આપે છે.                           | ખરું, ખોટું |
| (૪) સુખ દુઃખની વારતા હાથમાં હાથ ભીડીને કહે છે.                     | ખરું, ખોટું |
| (૫) કવિ નોટ - સિક્કાને ખિસ્સામાં નાખી ધૂળિયે મારગ ચાલવાનું કહે છે. | ખરું, ખોટું |

એકમ નંબર - ૬ એકમનું નામ - ધૂળિયે મારગ (ગુજરાતી, ધોરણ -૮)

પ્રશ્ન - ૬ 'અ' વિભાગના જવાબ 'બ' વિભાગમાંથી શોધી તેનો ક્રમ નીચે આપેલ 'અ' વિભાગના નંબર સામે લખો.

'અ' વિભાગ

(૧) ઉપરવાળી બેંક

(૨) સોનાની ગલી

(૩) મન

(૪) ધૂળિયો મારગ

(૫) નાનકડું ગામડું

'બ' વિભાગ

(ક) સાત્વિક જીવન

(ખ) માલામાલ

(ગ) લાભદાયી

(ઘ) સાંકડી

(ચ) ભોળા